

દાવો રજુ થયા તારીખ :- ૦૫/૦૫/૨૦૧૬

દાવો દાખલ થયા તારીખ :- ૦૫/૦૫/૨૦૧૬

ફેસલ તારીખ :- ૧૮/૧૨/૨૦૨૧

અવધિ :- વર્ષ-માસ-દિવસ

મહે. ઝાલોદની પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ સમક્ષ,

મું.ઝાલોદ.

જુનો સ્પે.દિ.મુ.નંબર : ૨૦/૨૦૧૬

નવો સ્પે.દિ.મુ.નંબર : ૩૧/૨૦૧૭

આંક : ૪૦

વાદી :-

બ્રાંચ મેનેજરશ્રી,
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઝાલોદ શાખા
ઉ.વ.૪૨, ધંધો-નોકરી,
મું.એસ.બી.આઈ.ઝાલોદ, ટાવર નજીક,
બસ સ્ટેશન રોડ, ઝાલોદ, તા.ઝાલોદ, જી.દાહોદ.

વિરુદ્ધ

પ્રતિવાદી :-

ધનાભાઈ બીજીયાભાઈ ચારેલ
રહે.ડુંગરાના પાણી, તા.ફતેપુરા, જી.દાહોદ.

:: દાવો રૂ. ૬,૨૪,૧૮૮.૮૮/- નાં આંકથી વસુલાતનો દાવો ::

વાદી તરફ વિ.વ.શ્રી એસ.એસ.બેદવાન

પ્રતિવાદી તરફ વિ.વ.શ્રી...

-:: જજમેન્ટ ::-

(૧) વાદી બેન્કે પ્રતિવાદી વિરુદ્ધ લોન પેટે બાકી નિકળતી રકમ વસૂલ મેળવવા હાલનો આ દાવો કરેલ છે. વાદીના દાવાની ટુંકમાં હકીકત એવી છે કે, વાદી સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જે રાષ્ટ્રીકૃત બેંક છે અને તે કાયદાથી સ્થપાયેલ તેમજ બેન્કીંગનો ધંધો વ્યવસાય કરતી સંસ્થા જેની ભારત ભરમાં અને પરદેશમાં શાખા છે. જેની એક શાખા ઝાલોદ મુકામે ટાવર નજીક, બસ સ્ટેશન રોડ, ઝાલોદમાં આવેલ છે. જેનો કોડ નં.૦૦૨૭૩ છે અને વાદીએ બેંક વતી બેંકના બ્રાન્ચ મેનેજરની હેસીયતથી દાવો કરેલ છે. આ કામના પ્રતિવાદીને ખેતી માટે ટ્રેક્ટર લોન પેટે નાણાંની જરૂર હોવાથી વાદી બેંકમાં લોન ધિરાણ માટે અરજી કરતા તા.૦૬.૦૧.૨૦૦૭ ના રોજ ધિરાણની રકમ રૂ.૪,૮૫,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પંચાણું હજાર પુરા વાર્ષિક ૧૪.૫૫ વ્યાજ દરે આપેલ. સદર અરજી બાબતે પ્રતિવાદીએ જરૂરી પેપર્સ સહીઓ કરી અને જરૂરી દસ્તાવેજો પુરા પાડતા બેંકના નિયમો મુજબ ૧૪.૫૫% વ્યાજ નક્કી કરી

તે અંગેના લેખ, લખાણો વાદી બેંકને લખી આપેલ. સદર પ્રતિવાદીને તા.૦૬.૦૧.૨૦૦૭ ના રોજ ધિરાણની રકમ રૂા.૪,૯૫,૦૦૦/-વાદી બેંકે વાર્ષીક વ્યાજદરે આપેલ. જેનો લોન ખાતા નં.૩૦૧૧૦૦૯૫૭૨૩ છે.જે લોન બાબતે પ્રતિવાદીએ મોલારા,તા.સંતરામપુરની રેવન્યુ ખાતા નં.૫૭ વાળી (૧) રે.સ.નં.૬-અ વાળી ક્ષેત્રફળ હે.૦-૨૨-૦૦, આકાર રૂા.૧-૧૮, (૨) રે.સ.નં.૮, ક્ષેત્રફળ હે.૧-૧૮-૦૦, આકાર રૂા.૫-૮૫ (૩) રે.સ.નં.૧૬૪, ક્ષેત્રફળ હે.૦૦-૬૬-૦૦, આકાર રૂા.૧.૭૫ પૈસા વાળી ખેતીલાયક જમીન તારણમાં મુકેલી છે અને તે અંગે સદર દહેણાનું અંગીકરણ પ્રતિવાદીએ કરી આપેલ છે.આ કામના પ્રતિવાદી એ ધીરાણ લીધા બાદ નીચમીત હપ્તા તથા વ્યાજ ભરેલ નથી, જેથી વાદી બેંક દ્વારા તા.૩૧.૧૨.૨૦૧૦, તા.૩૦.૦૬.૨૦૧૧ તથા તા.૦૬.૦૬.૨૦૧૨ ના રોજ નોટીસો આપવા છતા તેમજ વાદી બેંકના વકીલશ્રીએ પણ તા.૦૪.૦૪.૨૦૧૧, તા.૨૫.૦૮.૨૦૧૨, તા.૧૬.૦૫.૨૦૧૩, તા.૧૩.૦૬.૨૦૧૩ તથા તા.૨૧.૧૧.૨૦૧૫ ના રોજ વારંવાર લેખીતમાં નોટીસો આપવા છતાં પ્રતિવાદીએ નિયમીત હપ્તા ભરેલ નહી. જેથી પ્રતિવાદી પાસે વાદી બેંકને રૂા.૬,૨૪,૧૮૮.૮૮/- અને ત્યારથી પ્રતિવાદીએ સદર લોન વસુલ કરવા હાલનો આ દાવો કરવા કારણ ઉત્પન થયેલ છે, જેથી હાલનો દાવો કરેલ છે.

(૨) પ્રતિવાદીને વાદીના દાવાનો સમન્સ/નોટિશ બજી જતા તેમ છતા દાવાના કામે કોઈ રીપોર્ટ કે રજુઆત કરેલ નથી. જેથી પ્રતિવાદીનો જવાબનો હકકબંધ કરવામાં આવેલ છે.

(૩) આ કામે વાદી તર્ફ પુરાવાનાં તબકકે નીચે મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ થયેલ છે.

મૌખિક પુરાવા :-

૧. આંક-૧૭ થી વાદી બેંકના મેનેજરશ્રી પ્રકાશભાઈ નીમ્બાભાઈ પાટીલની સોગંદ ઉપરની જુબાની.

દસ્તાવેજી પુરાવા:-

૧. આંક-૨૧ થી લોના ખાતાના સ્ટેટમેન્ટની કોમ્પ્યુટરાઈઝ નકલ
૨. આંક-૨૨ થી પ્રતિવાદીના ખેત ધીરાણ માટેનું લોન અરજીપત્રક અસલ
૩. આંક-૨૩ થી મોલારાના ખાતા નં.૫૭ ની ૮/અ ની નકલ
૪. આંક-૨૪ થી મોલારા ગામના રે.સ.નં.૬-અ ની ૭ ની નકલ
૫. આંક-૨૫ થી મોલારા ગામના રે.સ.નં.૮ ની ૭ ની નકલ
૬. આંક-૨૬ થી મોલારા ગામના રે.સ.નં.૧૬૪ ની ૭ ની નકલ
૭. આંક-૨૭ થી પરિશિષ્ટ 'એ'
૮. આંક-૨૮ થી સાનગીરોનો કરાર
૯. આંક-૨૯ થી ઈન્ટોલમેન્ટ લેટર અસલ
૧૦. આંક-૩૦ થી આર.ટી.ઓ. આપેલ અસલ સર્ટી
૧૧. આંક-૩૧ થી આર.ટી.ઓ. આપેલ અસલ સર્ટી

૧૨. આંક-૩૨ થી લોન ફરી ચાલુ કરવાનો પત્ર

૧૩. આંક-૩૩ થી પહોંચ અસલ

ત્યારબાદ આ કામે વાદી તરફે વધુ કોઈ પુરાવો રજુ કરેલ નથી.

(૪) આ કામે પ્રતિવાદી તરફે કોઈ પુરાવો રજુ કરવામાં આવેલ ન હોઈ ન્યાયના હિતમાં પ્રતિવાદીના પુરાવાનો હકક બંધ કરવામાં આવેલ છે. તેમજ આ કામે વાદી તરફે આંક-૩૭ થી પ્રતિવાદીનો ઉલટતપાસનો હકક બંધ કરવા કરવા માટેની અરજી રજુ થયેલ છે. જે અરજી મંજૂર કરી આંક-૦૧ લગત હુકમ કરી પ્રતિવાદીને આંક-૩૪ થી આંક-૩૬ થી નોટીશ બજી ગયેલ હોવા છતા હાજર ન હોય પ્રતિવાદીને પુરતી તક આપવા છતા હાજર નથી. જેથી પ્રતિવાદીનો ઉલટતપાસનો હક બંધ કરેલ છે.

(૫) ત્યારબાદ આ કામે વાદી તરફે તેઓના વિધ્વાન વકીલશ્રી એસ.એસ.બેદવાનની દલીલો સાંભળવામાં આવેલ છે. તેમજ આ કામે વાદી તરફે આંક-૩૮ થી પ્રતિવાદીનો દલીલનો હક બંધ કરવા અરજી કરેલ છે. જે અરજી મંજૂર કરી આંક-૦૧ લગત હુકમ કરી પ્રતિવાદીનો દલીલનો હકબંધ કરેલ છે.

(૬) આ કામે ઉપરોક્ત દાવાના નિર્ણય માટે આંક-૦૭ થી નીચે મુજબના મુદ્દા ઘડેલ છે.

- 1] Whether the plaintiff proves that Plaintiff is entitled to recover suit amount from the defendants ?
- 2] Whether the plaintiff proves that plaintiff is entitled to get Interest on Suit amount ? If yes, at what Rate ?
- 3] What order and decree?

(૭) ઉપરોક્ત મુદ્દાઓ પરત્વેના નિર્ણય નીચે મુજબ છે.

(૧) હકારમાં.

(૨) હકારમાં.

(૩) આખરી હુકમ મુજબ.

—:: નિર્ણયના કારણો ::—

મુદ્દા નં.૧ થી ૨ ની ચર્ચા :-

(૮) આ કામે ઉપરોક્ત તમામ મુદ્દાઓ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા હોય દરેક મુદ્દાઓની અલગ છણાવટ કરતા પુનઃઉક્ત થાય તેમ હોય મુદ્દા નં.૧ થી ૨ ની સંયુક્ત ચર્ચા કરવામાં આવે છે.

(૯) આ કામમાં વાદી બેન્કના સાહેદ પ્રકાશભાઈ નીમ્બાભાઈ પાટીલ કે જે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઝાલોદ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સદર સાહેદે આંક-૧૭ ની પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે, વાદી સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જે રાષ્ટ્રીકૃત બેંક છે અને તે કાયદાથી સ્થપાયેલ તેમજ બેન્કીંગનો ધંધો વ્યવસાય કરતી સંસ્થા જેની ભારત ભરમાં અને પરદેશમાં શાખા છે. જેની એક શાખા ઝાલોદ મુકામે ટાવર નજીક, બસ સ્ટેશન રોડ, ઝાલોદમાં આવેલ છે. જેનો કોડ નં.૦૦૨૭૩ છે અને વાદીએ બેંક વતી બેંકના બ્રાન્ચ મેનેજરની હેસીયતથી દાવો કરેલ છે.

(૯.૧) આ કામના પ્રતિવાદીને ખેતી માટે ટ્રેક્ટર લોન પેટે નાણાંની જરૂર હોવાથી વાદી બેંકમાં લોન ધિરાણ માટે અરજી કરતા તા.૦૬.૦૧.૨૦૦૭ ના રોજ ધિરાણની રકમ રૂ.૪,૯૫,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પંચાણું હજાર પુરા વાર્ષિક ૧૪.૫૫ વ્યાજ દરે આપેલ. સદર અરજી બાબતે પ્રતિવાદીએ જરૂરી પેપર્સ સહીઓ કરી અને જરૂરી દસ્તાવેજો પુરા પાડતા બેંકના નિયમો મુજબ ૧૪.૫૫% વ્યાજ નક્કી કરી તે અંગેના લેખ, લખાણો વાદી બેંકને લખી આપેલ. સદર પ્રતિવાદીને તા.૦૬.૦૧.૨૦૦૭ ના રોજ ધિરાણની રકમ રૂ.૪,૯૫,૦૦૦/-વાદી બેંકે વાર્ષિક વ્યાજદરે આપેલ.જેનો લોન ખાતા નં.૩૦૧૧૦૦૮૫૭૨૩ છે. જે લોન બાબતે પ્રતિવાદીએ મોલારા,તા.સંતરામપુરની રેવન્યુ ખાતા નં.૫૭ વાળી (૧) રે.સ.નં.૬-અ વાળી ક્ષેત્રફળ હે.૦-૨૨-૦૦, આકાર રૂ.૧-૧૮, (૨) રે.સ.નં.૮, ક્ષેત્રફળ હે.૧-૧૮-૦૦, આકાર રૂ.૫-૮૫ (૩) રે.સ.નં.૧૬૪, ક્ષેત્રફળ હે.૦૦-૬૬-૦૦, આકાર રૂ.૧.૭૫ પૈસા વાળી ખેતીલાયક જમીન તારણમાં મુકેલી છે અને તે અંગે સદર હેણાનું અંગીકરણ પ્રતિવાદીએ કરી આપેલ છે.

(૯.૨) આ કામના પ્રતિવાદી એ ધીરાણ લીધા બાદ નીચમીત હપ્તા તથા વ્યાજ ભરેલ નથી, જેથી વાદી બેંક દ્વારા તા.૩૧.૧૨.૨૦૧૦, તા.૩૦.૦૬.૨૦૧૧ તથા તા.૦૬.૦૬.૨૦૧૨ ના રોજ નોટીસો આપવા છતા તેમજ વાદી બેંકના વકીલશ્રીએ પણ તા.૦૪.૦૪.૨૦૧૧, તા.૨૫.૦૮.૨૦૧૨, તા.૧૬.૦૫.૨૦૧૩, તા.૧૩.૦૬.૨૦૧૩ તથા તા.૨૧.૧૧.૨૦૧૫ ના રોજ વારંવાર લેખીતમાં નોટીસો આપવા છતાં પ્રતિવાદીએ નિયમીત હપ્તા ભરેલ નહી. જેથી પ્રતિવાદી પાસે વાદી બેંકને રૂ.૬,૨૪,૧૮૮.૮૮/- અને ત્યારથી પ્રતિવાદીએ સદર લોન વસુલ કરવા હાલનો આ દાવો કરવા કારણ ઉત્પન થયેલ હોવાની તમામ હકીકતોને વાદી તરફેના સાહેદએ પોતાની સોગંદઉપરની જુબાનીમાં સંપૂર્ણ સમર્થન કરેલ છે.

(૧૦) વાદી તરફેના ઉપરોક્ત જણાવેલ સાહેદના સોગંદ ઉપરના કથનો તથા પુરાવાઓને પ્રતિવાદી તરફથી કોઈપણ રીતે પડકારવામાં આવેલ નથી કે તેનું ખંડન કરવામાં

આવેલ નથી. પુરાવાના કાયદાના સિધ્ધાંતો તથા બેન્કીંગ રૂલ્સની જોગવાઈઓ ધ્યાનમાં લેતાં વાદીના પુરાવા પુરવાર માનવામાં આવે છે. તમામ પુરાવા પરથી જણાઈ આવે છે કે, પ્રતિવાદી એ વાદી બેંક પાસેથી ઘંઘાકીય ઉપયોગ માટે ટ્રેકટર લોન ધિરાણ માટે ઉપર જણાવ્યા મુજબની રકમની લોન શરતોને આધીન લીધેલ અને આ કામે વાદી બેંક ધ્વારા જે દાવો લાવવામાં આવેલ છે તે વાદી બેંકના ઝાલોદ બ્રાન્ચના મેનેજર ધ્વારા લાવવામાં આવેલ છે અને હાલના સાહેદ ઝાલોદ બેંકના બ્રાન્ચ મેનેજર છે અને બેંકમાંથી આપેલ ધિરાણ ડીફોલ્ટરો પાસેથી બેંકના હિતમાં વસુલ કરવા અને તે અંગે જરૂરી તમામ કાયદાકીય પગલા ભરવા માટેના તમામ અધિકારો બેંકીંગ રૂલ્સ મુજબ શાખાના મેનેજરમાં નિહિત કરવામાં આવેલ હોય છે અને તે મુજબ પોતાના હોદ્દાની રૂએ તેઓએ હાલનો દાવો લાવેલ હોય અને આવો દાવો લાવવા તેમને સંપૂર્ણ ઓર્થોરાઈઝ કરેલ હોવાનું જણાઈ આવે છે.

(૧૧) આ કામે વાદી બેંકમાંથી લીધેલ લોન ધિરાણની રકમ વ્યાજ સાથે પ્રતિવાદી એ ભરપાઈ કરી આપવા કરાર કરેલ હોવા છતાં વાદી બેંકના અધિકારીઓ ધ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં પ્રતિવાદી ધ્વારા ધિરાણની રકમ નહીં ચુકવતા વાદી બેંકને આ દાવો કરવાનું કારણ ઉત્પન્ન થયેલ છે અને ઉપરોક્ત કરેલ તમામ ચર્ચા મુજબ પ્રતિવાદીએ જરૂરી દસ્તાવેજો તથા કરારો કરી આપી વાદી બેંકમાંથી લોન ધિરાણ મેળવેલ હોય અને જે નિયત સમયમાં પ્રતિવાદીએ ભરપાઈ ન કરી ધિરાણ મેળવવા અંગેની શરતોનો ભંગ કરેલ હોય ત્યારે વાદી બેંકે આપેલ લોન ધિરાણની બાકી નિળકતી રકમ રૂ.૬,૨૪,૧૮૮.૭૦/- પુરા વ્યાજ સાથે પ્રતિવાદી પાસેથી વસુલ મેળવવા હાલનો દાવો કરેલ છે અને આ કામે વાદી તરફે આંક-૨૧ થી રજુ પ્રતિવાદીના લોન ધિરાણ ખાતાનો ઉતારો જોતાં તેમાં વાદી બેંકના સાહેદના જણાવ્યા મુજબ પ્રતિવાદીએ છેલ્લે સને-૨૦૧૬ માં નાણાં જમા કરાવેલ ત્યાર પછીથી આ દાવો પણ સમય મર્યાદામાં હોય અને વાદી બેંકને પ્રતિવાદી પાસેથી તેમના ધિરાણ ખાતાના ઉતારા મુજબ રૂ.૩,૪૭,૨૧૬/- પુરા લેવાના બાકી નિકળે છે. વાદી દ્વારા હાલનો દાવો દાખલ કરી રૂ.૬,૨૪,૧૮૮.૭૦/-ની રકમનો દાવો કરેલ છે પરંતુ આ કામે આંક-૨૧ ધ્યાને લેવામાં આવે તો, તા.૦૪.૦૩.૨૦૧૬ ના રોજ રૂ.૩,૪૭,૨૧૬/- ની રકમ બાકી હોવાનું જણાય આવે છે. વાદી દ્વારા રૂ.૬,૨૪,૧૮૮.૭૦/- બાકી હોવા સંબંધે કોઈ ચોક્કસ ગણતરી કે દસ્તાવેજ રજુ રાખેલ નથી. આ કામે આંક-૧૭ નું પુરાવાનું સોગંધનામું ધ્યાને લેવામાં આવે તો તેમાં પણ માંગ્યા મુજબની રકમ મેળવવા અંગેનું ગણતરી દર્શાવેલ નથી. આમ, વાદીના પુરાવા આંક-૨૧ થી ફલીત થાય છે કે, દાવો કરતા અગાઉની તારીખે સને-૨૦૧૬ માં રૂ.૩,૪૭,૨૧૬/- નું બાકી હોવાનું હતું.

(૧૨) ઉપરોક્ત તમામ હકીકતે વાદીએ રજુ કરેલ પુરાવા ધ્યાને લેતા આ કામે આંક-૨૧ થી લોના ખાતાના સ્ટેટમેન્ટની કોમ્પ્યુટરાઈઝ નકલ, આંક-૨૨ થી પ્રતિવાદીના ખેત ધીરાણ માટેનું લોન અરજીપત્રક અસલ, આંક-૨૩ થી મોલારાના ખાતા નં.૫૭ ની ૮/અ ની નકલ, આંક-૨૪ થી મોલારા ગામના રે.સ.નં.૬-અ ની ૭ ની નકલ, આંક-૨૫ થી મોલારા ગામના રે.સ.નં.૮ ની ૭ ની નકલ, આંક-૨૬ થી મોલારા ગામના રે.સ.નં.૧૬૪ ની ૭ ની નકલ, આંક-૨૭ થી પરિશિષ્ટ 'એ', આંક-૨૮ થી સાનગીરોનો કરાર, આંક-૨૯ થી ઈન્ટોલમેન્ટ લેટર અસલ, આંક-૩૦ થી આર.ટી.ઓ. આપેલ અસલ સર્ટી, આંક-૩૧ થી આર.ટી.ઓ. આપેલ અસલ સર્ટી, આંક-૩૨ થી લોન ફરી ચાલુ કરવાનો પત્ર, આંક-૩૩ થી પહોંચ અસલ રજુ રાખેલ છે.

(૧૩) વાદી સંસ્થા બેન્કીંગ વ્યવસાય સાથે જોડાયેલ છે અને કરાર મુજબ વ્યાજે લોન ધિરાણ આપવાની કામગીરી કરે છે. તે હકીકતે વાદી કરારમાં જણાવ્યા મુજબનું વ્યાજ પ્રતિવાદી પાસે થી વસુલ મેળવવા હકદાર છે. આ કામમાં વાદી બેંકે ટ્રેકટર લોન આપેલ ધિરાણ ઉપર પ્રવર્તમાન શું વ્યાજ દર ચાલે છે તે અંગેનો પુરાવો આંક-૨૮ ના સાનગીરોના કરારમાં જણાવેલ નથી તેમ છતાં પ્રવર્તમાન વ્યાજના દરને ધ્યાને લેતા ૬.૦૦ % દાવાની તારીખથી વ્યાજ સાથેની રકમ વસુલ મેળવવા વાદી બેંક હકદાર હોવાનું ઠરાવી મુદ્દા નં.૧,૨ હકારમાં ઠરાવી અને મુદ્દા નં.૩ અન્વયે નીચે મુજબ આખરી હુકમ કરવામા આવે છે.

—: આખરી હુકમ :—

- વાદીનો દાવો મંજૂર કરવામાં આવે છે. આ કામના વાદી બેંક પ્રતિવાદી પાસે થી રૂ.૩,૪૭,૨૧૬/—(અંકે રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર બસો સોળ) પુરા દાવા તારીખથી ૬.૦૦% ના વાર્ષિક સાદા વ્યાજ સાથે ચડયે ચડી રકમ વસૂલ ન આવે ત્યાં સુધીની રકમ પ્રતિવાદીની જાત તથા દરેક પ્રકારની મિલકતમાંથી વસૂલ મેળવવા હકદાર હોવાનું ઠરાવવામાં આવે છે.
- વાદીને થયેલ ખર્ચ પ્રતિવાદીએ ચુકવવું.
- હુકમ મુજબનું હુકમનામું દોરવું.

આ હુકમ આજરોજ તારીખ:-૧૮મી, માહે:-ડીસેમ્બર, સને:-૨૦૨૧ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તારીખ : ૧૮/૧૨/૨૦૨૧

સ્થળ : ઝાલોદ.

(કર્દમ ચંદ્રવદન જોષી)

પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ, ઝાલોદ.

COD NO.G.J.01132